

M.A. Semester - 3 (CBCS) Examination

Oct/Nov. - 2018

INTERNATIONAL ECONOMICS -1 (CORE)

Time: 2:30 Hours

Marks: 70

Instructions:

1. All questions are compulsory.
2. Figures to the right indicate marks.

- પ્રશ્ન-૧ આંતરરાષ્ટ્રીય વ્યાપારનો તુલનાત્મક ખર્ચનો સિદ્ધાંત સમજાવી તેની મર્યાદા જણાવો. (૧૪)
અથવા
- પ્રશ્ન-૧ “આંતરરાષ્ટ્રીય વ્યાપાર વિકાસનું એજન્ડા છે.” – સમજાવો.
- પ્રશ્ન-૨ આંતરરાષ્ટ્રીય વ્યાપાર સંબંધી હેક્સર-ઓરલિનનાં સિદ્ધાંતની છણાવટ કરો. (૧૪)
અથવા
- પ્રશ્ન-૨ વ્યાપારની શરતોને અસરકર્તા પરિબલો વર્ણવો.
- પ્રશ્ન-૩ વ્યાપારતુલા અને લેણદેણની તુલા વિશે સમજાવો. લેણદેણની તુલાની ખાદ્ય માટે જવાબદાર પરિબલો વર્ણવો. (૧૪)
અથવા
- પ્રશ્ન-૩ (અ) વ્યાપાર અને શ્રમકુશળતા ડોનાલ્ડ કિસીંગનો સિદ્ધાંત સમજાવો.
(બ) સંશોધન વિકાસ અને વિકાસ પરિબલ તથા વસ્તુ વ્યાપારનું માળખું ગુબર મહેતા અને વર્નોનનો સિદ્ધાંત સમજાવો.
- પ્રશ્ન-૪ વ્યાપારની શરતો એટલે શું? તેના વિવિધ ખ્યાલ વર્ણવો. (૧૪)
અથવા
- પ્રશ્ન-૪ સુવર્ણ ધોરણ હેઠળ સંચાલિત પદ્ધતિમાં લેણદેણની તુલાની અસમતુલા નિવારવાની પ્રક્રિયા વર્ણવો.
- પ્રશ્ન-૫ નીચેનાં ચાર પ્રશ્નોમાંથી કોઈપણ બે નાં જવાબ આપો. (૧૪)
- (૧) લિયોન્ટીફ વિરોધાભાસ
(૨) આંતરિક અને આંતરરાષ્ટ્રીય વ્યાપાર વચ્ચેનો તફાવત.
(૩) જકાતની અસર.
(૪) લેણદેણની તુલાની અસમતુલા નિવારવાનાં ઉપાયો.

ENGLISH VERSION

- Que-1 Explain the comparative cost theory of international trade and discuss its limitation. (14)
OR
- Que-1 Explain “Trade is an Engine of economic growth”.
- Que-2 Analyse the Hecksher Ohlin theory of international Trade. (14)
OR
- Que-2 Describe the factors affecting Terms of Trade.
- Que-3 Explain the balance of Trade and balance of Payment, Describe the responsible factors for the deficit imbalance of Payment. (14)
OR
- Que-3 (A) Explain Trade and labour skills theory by Donald Kessing.
(B) Explain “Research and Development factors and structure of commodity Trade by Gruber Mehta and Vernon theory.
- Que-4 What is meant by the terms of Trade, describe its various concept. (14)
OR
- Que-4 Describe the process of adjustment under systems of Gold standard steps to correct imbalance of payment.
- Que-5 Write any two answers following four questions. (14)
(1) Leontief Paradox.
(2) Difference between internal Trade and international Trade.
(3) Impacts of Tariffs.
(4) The measures to correct imbalance of payment.
